

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

:- અખબારી યાદી:-

PM Street Vendors AtmaNirbharNidhi(PM SVAnidhi) પુરસ્કૃત યોજનાનો રાજકોટ શહેરના તમામ ફેરિયાઓને લાભ મળી રહે તે માટે મનપા દ્વારા કેમ્પનું આયોજન

તારીખ: ૧૫-૦૯-૨૦૨૦



પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર (PM SVAnidhi) યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને આજીવિકાનાં હેતુસર આવાસ અને શહેરી બાબતો મંત્રાલય દ્વારા COVID-19 થી અસરગ્રસ્ત શહેરી ફેરિયાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા માટે ભારત સરકારશ્રી દ્વારા PM Street Vendors AtmaNirbharNidhi(PM SVAnidhi) a scheme for special micro-credit facility, ૧૦૦% કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના લાગુ કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ શહેરી ફેરિયાઓને બેંક દ્વારા રૂ , ૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે. આ યોજનાનો રાજકોટ શહેરના તમામ ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર

રાજકોટ મહાનગરપાલિકા ની પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના તમામ હોકર્સ ઝોન શહેરના તમામ રાજમાર્ગો ઉપર છુટા છવાયા ફેરી કરતા તમામ ફેરિયાઓનો સંપર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજનાના અસરકારક અમલીકરણ અને ફેરિયાઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર નીચે દર્શાવેલ ફેરીઓના રહેઠાણ તેમજ હોકર્સ ઝોન તથા જાહેરમાર્ગો ઉપર જરૂરી પ્રચાર પ્રસાર કરી અત્યાર સુધીમાં નીચેની વિગતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સાથો સાથ આ લોન અંગેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવતી હોય દરેક ફેરિયાઓનાં આધારકાર્ડ સાથે લીંક કરેલ મોબાઈલ નંબર ચાલુ હોવો જરૂરી હોય કેમ્પના સ્થળે આધાર કાર્ડની કીટ પણ ઉપલબ્ધ કરાવી સ્થળ ઉપર જ આધાર સંબંધિત પ્રક્રિયા પૂર્ણ થાય તેપ્રકારની કામગીરી કરવામાં આવે છે.

| વોર્ડ નં. | કેમ્પનું સ્થળ | તારીખ |
|-----------|---|----------|
| ૩ | જયુબેલી શાક માર્કેટ, રાજકોટ | ૧૮-૦૭-૨૦ |
| ૪ | ભગવતીપરા શાક માર્કેટ, રાજકોટ | ૨૦-૦૭-૨૦ |
| ૩ | રેલ્વેજંકશન રોડ, ડાક બંગલા, રાજકોટ | ૨૧-૦૭-૨૦ |
| ૪ | સેટેલાઈટ ચોક હોકર્સ ઝોન, રાજકોટ | ૨૨-૦૭-૨૦ |
| ૩ | આસ્થા ચોક રેલનગર, રાજકોટ | ૨૫-૦૭-૨૦ |
| ૨ | છોટુનગર, આંગણવાડી, રાજકોટ | ૨૫-૦૭-૨૦ |
| ૨ | છોટુનગર, હનુમાનમઢી, રૈયા રોડ, રાજકોટ | ૩૧-૦૭-૨૦ |
| ૨ | રેસકોર્ષ આઈ ગેલેરી | ૩૦-૦૭-૨૦ |
| ૩ | જયુબેલી શાક માર્કેટ, રાજકોટ | ૦૨-૦૮-૨૦ |
| ૨ | એરપોર્ટ બહુમાળી, રાજકોટ | ૦૮-૦૮-૨૦ |
| ૧ | રૈયાધાર, રાજકોટ | ૦૫-૦૮-૨૦ |
| ૧ | રૈયાધાર, રાજકોટ | ૨૬-૦૮-૨૦ |
| ૧ | રૈયાધાર આંગણવાડી, રાજકોટ | ૧૭-૦૮-૨૦ |
| ૧ | રૈયાધાર આવાસ યોજના, રાજકોટ | ૦૧-૦૮-૨૦ |
| ૧ | રૈયાધાર આવાસ યોજના, ૧૩ માળ, રાજકોટ | ૦૨-૦૮-૨૦ |
| ૧ | રૈયાધાર ચાર બાઈ મદિરરાજકોટ | ૨૭-૦૮-૨૦ |
| ૬ | સાગરનગર, માર્કેટિંગ યાર્ડ પાસે, રાજકોટ | ૦૨-૦૮-૨૦ |
| ૩ | કિટીપરા આવાસ યોજના, શાળા નં.૪૦, રાજકોટ | ૦૩-૦૮-૨૦ |
| ૧૧ | ધરમનગર, ૪૦ ફૂટ રોડ, રાજકોટ | ૧૦-૦૮-૨૦ |
| ૧૧ | જ્યોતિ કોમ્પ્લેક્સ, મવડી મેઈન રોડ, રાજકોટ | ૧૦-૦૮-૨૦ |

ઉક્ત કામગીરી શહેરી ફેરિયાઓને સરળતાથી વધુને વધુ લાભ મળે અને સમગ્ર રાજકોટ શહેરનાં ફેરિયાઓ આ યોજનામાં જોડાય તે માટે કરવામાં આવેલ છે. ઉપરાંત બેંકો તરફથી વધુને વધુ લોન અરજીઓ મંજૂર થાય તે દિશામાં તમામ બેંકર્સની મીટીંગ પણ દર અઠવાડિયે માન.

કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ ના માર્ગદર્શનથી નાયબ કમિશનર શ્રી સી .કે. નંદાણી ની અધ્યક્ષતામાં યોજવામાં આવે છે.

વિશેષમાં આ યોજના અંતર્ગત અંદાજીત રૂ ૭૦૦ થી વધુ ફેરિયાઓ એ લોન ફોર્મ ભરેલ છે. અને ૫૦૦ થી વધુ લોન અરજીઓ મંજૂર પણ કરવામાં આવેલ હોય , આ કેમ્પનો લાભ વધુને વધુ શહેરી ફેરિયાઓ ને લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ PM SVANidhi યોજનાનો લાભ રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા રૂમ નં.૯ ઢેબર રોડ ખાતેથી મળી શકશે. તદ્દપરાંત આ કામગીરી માટે પ્રોજેક્ટ શાખા દ્વારા દરેક શેરી ફેરિયા નો સંપર્ક પણ કરવામાં આવતો હોય, શેરી ફેરિયાઓએ આધાર કાર્ડ ચુંટણી કાર્ડ, બેંક પાસબુકની નકલ તથા જે શેરી ફેરિયા પાસે ફેરિયાનું રજીસ્ટ્રેશન કાર્ડ તથા સર્ટીફિકેટ સાથે રાખવા નોંધ લેશો.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા